

# સસલાઓ માટે દૈનિક આહારની રૂપરેખા



ક્રમ	સસલાનો પ્રકાર	અંદાજિત શરીરનું વજન	દૈનિક ખોકારની માત્રા	
			દાણ	લીલો ઘાસચારો
૧	નર સસલાં	૪-૫ કિલો	૧૭૫ ગ્રામ	૨૦૦ ગ્રામ
૨	માદા સસલી	૪-૫ કિલો	૧૫૦ ગ્રામ	૨૦૦ ગ્રામ
૩	બચ્ચા ઘરાવતી સસલી	--	૨૦૦ ગ્રામ	૨૫૦ ગ્રામ
૪	ઘાવણ છોડાયેલ બચ્ચા (૬ અઠવાડિયાની ઉંમર)	૬૦૦-૭૦૦ ગ્રામ	૫૦ ગ્રામ	૧૦૦ ગ્રામ

## સસલા દાણ બનાવવા માટેની કેટલીક ફોર્મ્યુલાઓ

ક્રમ	દાણ માટેના ઘટક પદાર્થો	૧૦૦ ગ્રામ દાણ બનાવવા માટે જથ્થો	
		ફોર્મ્યુલા-૧	ફોર્મ્યુલા-૨
૧	ઘઉં/મકાઈ/બાજરી દાણા	૪૦	૪૬
૨	ચોખા/ડાંગરની કુશ્કી	૨૦	૨૬
૩	મગફળીનો ખોળ	૩૦	૨૦
૪	માંસનો ભૂકો	૦૮	૦૬
૫	ક્ષાર મિશ્રણ	૧.૫	૧.૫
૬	મીઠું	૦.૫	૦.૫
	દાણમાં પ્રોટીનનું પ્રમાણ (ટકા)	૨૦	૧૪